

MEHTA INTEGRATED FINANCE LIMITED

CIN - L65910GJ1985PLC007692

Date: 25/05/2024

To, BSE Limited Corporate Relationship Department PJ Towers, Fort, Dalal Street, Mumbai - 400 001

Sub.:- Prior Notice of Board Meeting scheduled on 29.05.2024 for the consideration and approval of Audited Financial Results for the 4th Quarter & Financial year ended 31.03.2024 – Publication of Advertisement in News Papers

Scrip Code: 511377

Dear Sir/Madam,

In continuation of our Prior Intimation of Board Meeting given on 21.05.2023 for Board Meeting scheduled to be held on 29.05.2024 for consideration of Audited Financial Results for the 4th quarter and Financial Year ended on 31.03.2024 under regulation 29 of SEBI(LODR) Regulations, 2015 submitted to the Exchange on 21.05.2024, please find enclosed the copy of the prior intimation of Board Meeting notice advertisement published in English Edition (Free Press) and in Regional Language Gujarati Edition (Lok Mitra) on 22.05.2024 for information and Record.

Kindly take the same on record.

Thanking You,

Yours faithfully, For, Mehta Integrated Finance Limited



Kamleshbhai P. Patel Company Secretary & Compliance Officer

Enclosure: A/a

FREE PRESS GUJARAT

It's party time

tercentennial birth anniversary fell only a week ago. It would not be erroneous to speculate that these days, chintan baithaks at 6 Deen Dayal Upa-dhyaya Marg — the swanky headquarters of the Bharatiya Janata Party in New Delhi — tend to dwell on ways to cross the chaar sau seat hurdle in the ongoing parliamentary elections. At another address in the same city, 24 Akbar Road — the Congress HQ — the modo could well be that of aar ya part. this, after all, is a do or die poll battle for India's Grand Old Party that has been, for a decade, a mere pawn to the BJP's dashing knight on the chessboard of power. But what could possibly be on the minds of the minders of the political party located in Patna's Khagaul Road? At a time when India's national and regional outfits are hatching plans to occup Delhi's kursi, The Plurals Party, which, Wikipedia says, is located on the third floor of the Sukhbaso Compilex on Patna's Khagaul Road, may well be — mindas or usesivism, "Libtis — tit is an uneducated guess — makes it an oddity, it would be a pity. That's because when Indian politics has turned its face away from philosophical values or vision, The Plurals Party pledges "Kantains", apart phillar of the ideological template that it wants the nation to phills opher's tercentennial birth anniversary fell only a week ago.

Why China disbanded oncetouted Strategic Support Force: Implications for India



As a part of the most touted major security structure reforms, Chinese President Xi Jinping created the Strategic Support Force (SSF) in becember 2015. And now, on April 19, 2024, the SSF met its death (kall in yet another restructuring of the People's Liberation Army (PLA). The PLA now has three Information Support Force (ISF), the Cyberspace Force. ... China is known for its lack of transparency. Whether this change has been done to enhance military operational control over various elements is being analysed. Could corruntion have played a part

is being analysed. Could corruption have played a part in Xi's decision, is being

in Xi's decision, is verny speculated. The Ukraine conflict has surely highlighted the importance of the logistics and information domains. Space and cyber are other very dominant operational domains. Aerospace force could mean the partial merging of air and space domains. It may be recalled that China created the "Near Space Command" in recalled that China created une "Near Space Command" in November 2023. The 2015 PLA reforms

changes, including the formation of theatre commands. The then-newly created SSF was focused on created SSF was focused on space, counter-space, and information warfare capabilities. It was meant to improve the PLA's ability to fight what China calls "informatised conflicts" and to simultaneously enhance the PLA's power projection a little more than eight years.

capabilities in space and cyberspace. SSF was designed to ease intelligence sharing to ease intelligence sharing and coordination with departments of the different

and coordination with departments of the different branches. The nearly 250,000 personnel force represented nearly 10 per cent of the military. The SSF was on par-with the other military services and the PLA's five operational theatre commands. Later, the overall responsibility for national and joint military communication networks was also shifted to SSF control. The SSF oversaw all units responsible for psychological warfare, information warfare, space warfare, cyberwarfare, and electroic varfare tasks, command and control were spread thin, and individual unts were vying for resources. Also, the expertise required to command such a multifaceted force was complex. The SSF consolidated all the PLA's space-based all the PLA's space-based all the pLA's space-based all the spreading remains and an ordical strategic reconnaisance using the spy balloons filying in hear strategic reconnaissance using the spy balloons flying in 'near space' was also part of the SSF domain. When the Chinese spy balloons shooting down became a public spectacle, XI became a public spectacle, XI was reportedly unhappy with SSF. Splitting SSF will now allow more focus on each sector. The SSF used to report directly to the all-powerful China's Military Commission China's Military Commission (CMC), headed by President Xi Jinping. The SSF's previous mandate encompassed a wide array of responsibilities, potentially hindering operational effectiveness. It was therefore split within just

German Chancellor's China visit and growing divide between Berlin and Washington

German Chancellor Olaf Scholz was on his second visit to China in mid-April. He carried with him the traditional business deloation which forms the co carried with him the traditional business delegation, which forms the fulcrum of Germany's China policy. He visited Bosch Hydrogen Powertrain Systems in Chongqing before proceeding to the financial capital of Shanghai. On his final day, he was on the formal part of his visit to Beijing, where he met Premier Li Qiang and concluded the day with a meeting with President Xi Jinping. It was Scholz's first visi

side, German business remains concerned that the promises China made to provide better access to the with Chinese state-owned companies for access to the Chinese market and controls over the use of German technology are slow, if at all, in fulfiment. China, on its part, complains that it is not getting the kind of support they expected from Germany, and though they are still major investors and trading partners, the yface greater constraints in Europe and in Germany. China was Germany's eading trade partner for the eighth consecutive year in 2023, with <254.1 billion traded in goods and services more than German trade with the US but a 15.5 per cent diminution from 2022. German exports to China were •7.3 billion. Qiang and concluded the day with a meeting with President X Jinping. It was Scholz's first visit since the German China Strategy was announced in 2023, which annoyed China. Premier Li and a delegation of senior officials visited Berlin in June 2023. The strategy aimed at reducing dependence on the Chinese market in critical areas and bringing Germany into coherence with the EUS expectation was that Scholz would push the Ukraine crisis agenda more than the economic cooperation agenda. For Germany, economic cooperation with China is more critical and direct. With Ukraine, they are part of a larger game plan in which they don't see themselves as the incrhoin Scholz took un the billion. China would like Germany to be more autonomous of US action, just as Germany expects China boshow greater autonomy from Russia on the Ukraine issue. Perhaps both are misplaced perceptions. The US believed that Germany did not do enough for the calition Germany is thouing

coalition. Germany is showing that, given its own constraints and limitations, it is still trying to maintain a strategic autonomy over China, which has now more or less been larger game plan in which they don't see themselves as the linchpin. Scholz took up the Ukraine issue; there is no clarity on what the Chinese said on what they will tell Russia to do. On the economic

Chancellor Gerard Schroeder, who visited China six times between 1998 and 2005. The Christian Democratic Union's (CDU) Angela Merkel visited China 12 times in the 16 years

contacts with Xi and his team. United States Secretary of State Antony Blinken visited China after Scholz, Janet Yellen at the Treasury, and

China after Scholz, Janet Yellen at the Treasury, and Jake Sullivan as the NSA support Biden-Xi discussions. Germany sees the US speaking more loudly but also doing more to engage China to prevent a breakdown. The political de-risking that the US has undertaken has led Germany to believe that it has undertakén has led Germany to believe that it should not attempt economic decoupling but stick to the EU-led de-risking strategy on the economic side. Berlin is apprehensive that post-November US elections there could be a jolit in US politics, which would again leave Europe in general and

coalition. Germany is showing which would again leave that, given lisown constraints Europe in general and and limitations, it is still trying Germany in particular. In the to maintain a strategic lurch. Therefore, Germany autonomy over China, which has now more or less been vanquished with regart to Bus an Germany is aware that set up close and direct

that she was Chancellor. Not only does Scholz want to keep the strategic autonomy from the US, but even domestically, he wants to keep hold of the China policy within his government. The Greens-led China policy within his goverment. The Greens-led Foreign Ministry, particularly Foreign Ministry, Particularly demanding German policy towards China, linking it to human rights and possibly reducing the impact of the economic aspects on the policy. Scholz has not agreed with this approach and continues the dominating thoughts of German industry through the links that the Social Democratic Party (SPD) has with the Federation of Believes that derisking would continue, which would be a strategic economic concept but would not be economic alone ne. An analyst told me that Olaf

Ahmedahad Plus

An analyst bud me that Olaf Scholz's visit to China focused on the concerns of German businesses regarding unfair competition and inadeguate access to networks and public tenders. He discussed this with various stakeholders, including students at Tongi University in Shanghai and members of the German Chamber of Commerce. Scholz emphasised the importance of maintaining competitiveness without resorting to protectionist measures and pledged to raise these issues in his political meetings. German industry is anxious about the growing unfair practices they anxious about the growing unfair practices they and sout the growing indisadvantaged compared to their Chinese counterparts, including those in the EU. They worry about losing market share and fear the potential

2

repercussions of any retailatory measures if punitive actions, such as anti-dumping tariffs, are taken against Chinese imports under the China Strategy. This cleavage between the SPD and the Greens prevents Germany from playing a greater role within Europe. Strategically, most analysts believe that Scholz's visit to China shows the persistent policy of Germany, as the argest economic player in Europe, constrained by a similar central role within the ergostations that are more strategically inclined. This is perhaps because Germany's assessment is that the international system today assession t is that the international system today lacks stability and is facing crisis after crisis. The US and others believe that Germany could play a bigger role in the Ukraine by supplying weapons, by pushing china more, and by playing a role in West Asia. Germany sees that this instability also impacts Europe. German strength comes from its economy

SHRIRAM HOUSING FINANCE LIMITED

SHRIR & Reg.Off: Office No.123, Angappa Naicken Street, Chennai-600 Heusing Finance G Block, Bandra-Kurla Complex, Mumbai 400 051

SYMBOLIC POSSESSION NOTICE Whereas, The undersigned being the authorised officer of Shriram Housing Finance Limited (SHFL) under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2020 (said Act) and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2000 (said Rules) issued demand notices to the Borrowers details of which are mentioned in the table below to repay the amount mentioned in the said demand releven. notices

The Borrowers having failed to repay the amount, notice is hereby given to The Borrows in a name place to repay so tandom, nodes modely services the Borrows and the public in general that the undersigned has taken SYMBOLIC POSSESSION of the property described herein below in exercise o powers conference on him under Section 13(4) of the said Act read with rule 8 of the said Rules on 21/05/2024.

he public in general is hereby aling with the property will be Ltd. for an amount as mentior

Borrower's Name and Address	Demand Notice
section 13 of the Act, in respect of time available, to redeem 1	the secured assets.
The borrower's attention is invited to provisions of	sub-section (8) of

Ahmedabad Also Business Address :- Ward No.14, Bigga Bass, Shri Dungargarh, Bikaner, Rajasthan-331803 Also Property Address :- Office No.529, Sth Floor, Aviraj Pinnacle, Opp.Karnavati-4, NcDivine Life School, Vatva-Narol, Ahmedabad-382440

Pinnacle, Opp. Karnavali-4, Hr. RDVine Life School, Varva-Narol, Almediaba-382440 3. Brijdervi Birbal Ram, Pesent Address - Ward No 14, Bigga Bass, Shri Deugargarh, Bikaner, Rajashan-331603 Also Property Address - Ottice No.526, 5th Fioor, Aviraj Pinnacle, Opp. Karnavali-4, McDVine Life School, Vatva-Narol, Ahmedabad-382440

Place: Ahmedabad Date : 21-05-2024

Description of Mortgaged Property

Description of Mortgaged Property Al Ital pajese and parcel of Freehold Immovable property heling Office No.529 on 5th Flore, having carpet area admassuring 40.72 Sq.Mtrs.Lett.435 Sq.Mtrs.Bailt up 853.63 Sq.Fts.Saper Built up 8363.53 Sq.Fts.Saper Built up) in the scheme known as "Wrin] Pinnacle", situated at land survey no.5842, being Final Pfel No.3871, admessuring 7165 Sq.Mtrs paiki sub piol no.1 admassuring 2926 sq.mtrs of lown pianning scheme no.80 of mouje : V4ray. Taluka: 'Aviav, in the District of Ahmedabad and Registration Sub District of Ahmedabad-11 ((Astail) within the state of Gujarat. Boundaries of the said Property - Kast: 'Margin Space, West: Office No.528

No 528 Domond Nation

Borrower's Name and Address	Demand Notice
Mr.Kallash Kumar Chauhan, (Borrover) 2.Mrs. Laifladen Kallashbhai Chauhan (Co-Borover) Address :- Flat No.403, Aagam Residency, Acher Cross Road, Sarvoday Nagar Society, Sabarmati, Ahmedabad-380005 Also Having Address at: Flat No.504, Aagam Residency, Acher Cross Road, Sarvoday Nagar Society, Sabarmati, Ahmedabad- 380005	Rs. 41.79,824/- (Forty One Lakits Swenty, Nine Thousand Sik Hundred and Iventy Four Only as on 07-Mar- 24 under reference of Loan Account No. 5HL4HACA0001077 and Rs. 1,55.794/- (One Lakit Fifty Free Thousand Seven Hundred and Egity Nine Only as on 07-Mar-24 under reference of Loan Account No. SLFHAHEAD001070 with further interest and other costs, charges and expenses within 60 days from the date of receipt of the said notice. 13(2) Notice Date. 11/03/2024
Description of Mortgaged Property	
All the piece and parcel of immovable residential property being a Flat No. 504. On Fifth Floor, Having Area Admeasuring 97.82 Sq.Mtrs. (Super Built-Up) Admyth Undvided Share In Land In The Scheme Known As Yaagam Residency' Constructed 00 Sub Piot No. 34 & 30 Total Area Admeasuring 743. 30 Sq.Mtrs. OI Sarvoday Society Stubaied AI Land Bearing Revenue Survey No. 191/17 b G, 97 b 1, & 13 To 19, Being Final Piot No. 566, 567 & 568 OI Town Planning Scheme No.23 Admeasuring 2671 Sq. Mtrs. OI Mouje Village Acher, Taluka Subarmati And DisL. Ahmedabad In The Registration Sub-District And District Ol Ahmedabad-2 (Wada).	

Taluka Suparmau Anto Usa, Amerika District Of Ahmedabad - 2 (Wadal), Boundaries of the said Property :- East : Flat No.503, West : Passage & Road North : Flat No.501, South : Passage & Sarvoday Society

Sd/- Authorised Office Shriram Housing Finance Limited

Blinken's China visit: Trump factor looms large over Sino-American ties about the flood of cheap Chinese goods landing in the US, and anxious about China's

There were no great anticipations of any breakthrough from US Secretary of State Antony Blinken's recent visit to Shanghai and Beijing, but that does not indicate any insignificance of his five-hour-long conversations with his counterpart Chinese Foreign Minister Wang Yi and a brief meeting with Chinese strongman President Xi Jinping. For the last several months, both the Biden administration and the Xi Jinping regime have been carefully struggling to stop further erosion of Sino-US bilateral relations and to manage mounting differences over a host of challenging

manage motiting different uses over a host of challenging issues. US House Speaker Nancy Pelos's visit to Taiwan in the face of stark Chiness resistance, continuing US trade conflict despite and since Biden's predecessor imposed a high tariff on Chinese products, and apparent Chinese backup to Russia amidst the Ukraine War apparent Chinese backup to Russia amidst the Ukraine War that has culminated in a new Russo-American Cold War. Biden's disapproval of Beijing's demonstration of Quadrilateral Security Dialogue to regular disumit-level meetings, US allegations of Chinese Jumar rights violations in Xinjiang province and Undermining democracy in Hong Kong, and several other south China on a trajectory of Politicah costility and diplomatic confrontation. In a presidential election vear, the Biden administration open with China and staying ethe line of communication open with China and staying the line of convergent areal, Nancy Pelosi's controversial Taiwan visit and the shooting down of a Chinese balloon suspected of carving out

American sky had pushed the bilateral ties between the two



levers or os minicar, assistance to Ukraine and massive sanctions against Russian aggression failed to bring the Russian economy to its knees, disengaging in bilateral conversations with China would be counterproductive. It could further push China to embrace Russia and, by implication, heip Russia withstand US pressure. China had refused to hold military-to-military dialogue and had suspended numerous bilateral dialogues with the IUS due to a standoff

with the US due to a standoff on the Taiwan issue. It did not augur well for both countries, even as chances of accidental

conflict due to misunderstanding or miscommunication increased many fold. Many US allies in Europe and Asia also turned apprehensive over the Sino-American schism, and some of

American schism, and some of them expressed their difficulties in taking sides. The meetings between President Joe Biden and President XI Jinping in Bali during the G20 summit in 2022 during the G20 summit in 2022 and in San Francisco during the APEC meeting were mindful efforts to maintain interactions at the highest levels in order to reduce miscommunication and remove

misunderstandings. He these meetings had little these meetings had little encouraging outcomes in terms of normalising the relationship. The US-China differences over a number of key issues persisted for too long to further complicate the relationship. Restoration of normal channels of communication became or communication became essential, and thus Treasury Secretary Janet Yellen had already visited China twice to sort out issues related to trade and investment. And the recent visit to China by Secretary of State Blinken is the second one

about US restrictions on exports of critical technology, angry against the Biden administration discouraging American companies to invest in China in sectors that can boost its military capabilities, furious over US arms transfers to Taiwan, and agitated about Washington's efforts to create triangular and quadrilateral groupings like AUKUS, US-Japan-South Korea, and Japan-Philippines-US strategic collaborations. Since both sides have thoughful motives to keep holding dialogues, the language used during goods that can enable the Russian defence industry to run smoothly. in ten months. The telephonic conversations between the US Defence Secretary and his Chinese counterpart have also resumed. Yet, these are only signs of haves, restoration of normal US-China ties is a long way off. The reasons why both Washington and Beijing are willing to hold regular consultations a thigh levels are voluminous. The US has been consistently monitoring the rising technological power of China, concerned about China maintaining closer ties with Russia, North Korea, and Iran, aware of its inability to dismantie or prevent Chinese militarization of the South China Sea Islands, disturbed

run smoothly. MEHTA SECURITIES LIMITED CIN: L67120G31994PLC022740 Regd. Off: 2, Law Garden Apt. Scheme-1, Opp. Law Garden Ellisbridge, Ahmedabad-380006 Phone No. 91-79-26551000, 9377578519

website: www.mehtasecurities ail : mehtasec@yahoo.co.ir

NOTICE NOTICE In terms of Regulation 29(1) read with Regulation 47 of SEBI (Listing Obliga-tion & Disclosure Requirement) Regulations, 2015, it is hereby notified that meeting of the Board of Directors of the Company is scheduled to be held on Wednesday, 29th May 2024 inter alia to consider and approve the Audited Francial Results for the 4th quarter and financial year ended on 31st March, 2024 and to consider any other business if any. The said notice may be accessed on the Company's website : www.mehasecurities.com and may also be accessed on the website of Stock Exchange at tww baendia.com.

For Mehta Securities Limited Place: Ahmedabad Date: 21-05-2024 Mahesh Motiva MEHTA INTEGRATED FINANCE LIMITED CIN: L65910631985PLC007692 Regd. Off: 3, Law Garden Apt. Scheme-1, Opp. Law Garden, Ellibridge, Ahmedabad-380006 Phone No. 91-79-26561000 9377578519 website: www.nehaintegratedfinance.com Email: mill_in@yahou NOTICE

NOTICE In terms of Regulation 29(1) read with Regulation 47 of SEBI (Unting Obliga-tion & Doctosure Read of Denet) Regulations, 2015, it is hereby indiced. The Read of the Read of Denet and Read of the Read of the Read Wednesday, 291 May 2024 inter and Inancial year ended on 31st March, 2024 and to consider any other business if any. The said notice any other business if any. The said notice may be accessed on the Company's website www.mehtaintegratedfinance.com and may also be accessed on the websit of Stock Exchance at www.bseindia.com.

For Mehta Integrated Finance Limited

Place: Ahmedabad Date: 21.05.2024	Sd/ Kamleshbhai P. Pate Company Secretar	
--------------------------------------	--	--

	1.J.K.Enterprise Through it's proprietor
	Borrower's Name and Addre
	section 13 of the Act, in respect of time a
	The borrower's attention is invi
	below with interest thereon.
	the charge of Shriram Housing Finance I
-	not to deal with the property and any dea
	The Borrower in particular and th

US, and anxious about China's potential use of force against Taiwan. China, on the other hand, has been witnessing a slowdown in its economic growth, a meltdown of its real estate that contributes about one-third of its GDP, upset about US restrictions on exports of critical technology, annry, against the Biden r.J.A.Enterprise Through it's proprietor Dindyal Birbal Mot, Present Address : B-1, Anand Mangal Complex, Opp.Amul Garden, Shyamal Cross Road, Ambaw Ahmedabad

Vatverward, Ruinecadar-362-440 2. Dindyal Birbal Mot, Present Address :-46, Swetanjali Society, First Floor, Sachin Tower, Anandhagar Road, Ahmedabad Also Property Address :- Office No.529, Sth Floor, Aviraj Pinnacle, Opp.Karnavati-4, Nr.Divine Life School,

costs, charges and expenses within 6 days from the date of receipt of the said notice 13(2) Notice Date.11/03/2024

Rs. 30,72,256/-

HS. 30,72,250/-(Thirty Lakhs Seventy Two Thousand Two Hundred and Fifty Six Only) as on 07-Mar-24 under reference of Loan Account No.

Account No. SLPHAHMD000179 2 with further interest and other costs, charges and

લોકમિત્ર. LOKMITRA

તંત્રીશ્રીની કલમે

માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ ભારતની તરફેણમાં આપ્યો નિર્ણય

માલદીવમાં ભારતને મોટી રાહત મળી છે. મોહમ્મદ મોઇઝ્ઝુ યરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં પકડાયેલા ભારતીય જહાજ 'હોલી સ્પિરિટ અને તેના ઓપરેટર એન્ટની જ્યાબાલન પર લાદવામાં આવેલ ૪૨ લાખ માલદીવિયન રૂપિયાના દંડને માફ કરી દીધો હતો. માલદીવનો રૂ. ૪૨ લાખનો દંડ ભોરતના રૂ. ૨.૨૫ કરોડની બરાબર છે. આ નિર્ણય બાદ ભારતીય જહાજ માલદીવથી ભારત માટે રવાના થઈ ગયું છે. ભારતીય જહાજને સ્કહ્ય કોર્સ ગાર્ડ હાર ૨૦ ઝોકરોબરે અકાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે ૨૮ ઓક્ટોબરે માલદીવ નેશનલ ડિકેન્સ કોર્સ (એમઍનડીએફ) ે મેટે કે આ પ્રે કે આ પ્રે કે આ પ્રે સ્ટે બે પ્રે પ્રે કે આ પ્રે સ્ટે પ્રે સ્ટે પ્રે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ્ટે સ રકમ ચૂકવવા માટે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો . જો કે, જયારે રાષ્ટ્રપૂર્વ કાર્યાલયે દંડ માફ કર્યો, ત્યારે મંત્રાલયે કોર્ટમાંથી તેનો કેસ પાછો ખેંચી લીધો. બીજી તરફ ભારતે કહ્યું છે કે જો માલદીવના પાયલટોને ટ્રેનિંગ માટે ભારતની મદદની જરૂર પડશે તો ભારત ચોક્કસપણે કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ક્ષમતા નિર્માણ એ માલદીવ સાથેની ભારતની સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીનો એક ''મહત્વપૂર્ણ ઘટક'' છે અને જો નવી દિલ્હીને માહદીવ તરફળ પ્રાપ્ત પ્રાપ્ત પ્રવાર્શ કરે છે. આ ગામ માટે વિનંતી મળે છે, તો ''અમે તેનો વિચાર કરીશું.'' તેને આગળ લઈ જાઓ. વિદેશ મંત્રાલયના પ્રવક્ત, રક્ષધીર જયસ્વાલે એક પ્રેસ્ વાર્તાદરમિયાન માલદીવમાં છેડ્યન પેટેટ્સેર્મના સંચાલનને લગતા મુદ્રાઓ પરના અહેવાલ સાથે સંબંધિત એક પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "હા, લમતા નિર્માણ એ માલદીવ સાથેના અમારા સંરક્ષણ અને સુરક્ષ સંબંધોનો એક મહત્વપૂર્ણ ઘટક છે." અમે ભૂતકાળમાં તેમના કર્મચારીઓને સંરક્ષણ ક્ષેત્રમાં તાલીમ આપી છે અને જો અમને પાઇલટ્સની તાલીમ માટે વિનંતી મળે છે, તો અમે તેને આગળ વધારવામાં ખુશ થઈશું.

દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રાએ જણાવ્યું કે તે કેવી રીતે બની સ્ટાર

3ભા ૨૧.૫ ૧૫.૫ ૧૯.૫ બોલિવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોગાએ પોતાની એક્ટિંગ કરિયરમાં જે મુળંકેલીઓનો સામનો કરવો પહ્યો હતો તેના વિશે વાત કરી છે. અભિનેત્રોએ એક પાડકાર શોમાં જણાવ્યું કે તેની અભિનય સકલ્પતાં તેણે ઘળી બદવાસ સાંભળવી પડી. તેમજ તેની માતા તેની કારડિટીના સમર્થતમાં ન હતી. સાન્યાએ કહ્યું કે તેને પોતાની જાત પર વિશ્વાસ છે કે તે એ અભિનેતા અથવા ડાન્સર તરીડે પોતાનું કરિયર બનાવવા માંગે છે. પરંતુ તેની માતાને આ વાત મંજૂર ન હતી. આવી સ્થિતિમાં તેની વિચારસરછી બદલવા માટે માતા તેને પરિતો પાસે હઈ જતી હતી.

MEHTA SECURITIES LIMITED CIN: L67120G31994PLC022740 Regd. Off:: 2, Law Garden Apt. Scheme-1, Opp. Law Garden, Ellishridge, Ahmedabad-380006 Phone No. 91-79-2650100, 9377578519 bsite: www.mehtasecurities.com Email : mehtasec@yahoo.or The said not conduct and may also be accessed on the website of Stock Exchange and may also be accessed on the website of Stock Exchange and the second and the second accessed on the second second accession and the second accessed on the second accession accession and second accession accessed on the second accessed on the second accession accession accessed on the second accession accession accession accession accession and may also be accessed on the website of Stock Exchange at www.bendla.com and may also be accessed on the second accession accession and may also be accessed on the second accessed on the second accession accession and may also be accessed on the second accessed accessed on the second accessed on the second accessed on the second accessed accessed accessed accessecond accessed accessed accessecond



લેશા ઈન્ડસ્ટ્રીસ લિમીટેડ

CIN: L271006J1992PLC018607 રજીઝર્ડ ઑફીસ: ૭મે માલ, અશોકા ચેખ્યસે, મીઠાખલી છ રસ્તા, અમદાવાદ ૩૮૦૦૦૬. ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : caf.lesha@gmail.com, Website : www.lesha.ir

ં પ્રતીની વધારાની સામાન્ય સભા અંગેની જાણ કરતી નોટીસ, રીમોટ ઈ-વોટીંગ સહીતની માહીતી ઈ-મેઈલપી મોલકવામાં (જેમન ઈ-મેઈલ સરનામાં કંપની પાસે છે)આવ્યા છે.

રીમોઠ ઇ-ચોટીંગ : કંપનીઝ એસ, ૨૧૧ ક્વી કલમ ૧૦૮. કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિપ્ટ્રેશન) અમેન્ડમેન્ટ ફલ્મ, ૨૧૧પના નિલમ ૧૦ અને ક્ષે (સિક્રીલ ઓબીલીગેમલ એન્ટ સિક્લોઝર શિકાપરમેન્ટસ) કેમ્યુલેશન્સ, ૨૦૧૫ના, ટેચુલેશન ૪૪ અન્યે કંપની ઈ.ઓ.જી એમ. નેટીજમાં સાર્વેલ્યા કામડાજ અંગે સાચાની સામાન્ય સ્વામાં ઇલેટટ્રોરિક માધ્યબર્થી મલ ખાપી શકે તે માટે સબધેને શી.ગેસ, એ ના માધ્યબરી મીસરે છે. આંદ્રેઓ શ્રીસાથી શુધી પા છે. સબ્બેને સોકાયલમાં બેચલે છે. આંદ્ર જોન છે. આંદ્ર જોન સ્વાર્ગ સ અંગે છે. આંદ્ર છે. આંદ્ર બેસ બેસ છે. સ્વાર્ગ કે માંદ્ર સાથે આંદ્ર સ્વાર્ગ સ્વાર્થ આંદ્ર શ્રી છે. આંદ્ર જોન છે. સ . રીમોટ ઈ-વોટીંગ માટેની કટ ઓફ ડેટ ૭મો જૂબ, ૨૦૨૪ છે. ઈ-વોટીંગની સમયમર્યાઠા: ઈ-વોટીંગ ૧૧મો જૂબ, ૨૦૨૪ ના સવારે ૯:૦૦ કલાકે શરૂ થશે અને

- શકને નહીં. કે ગ્લાઓ રીમોર્ડ ઇ-ગોર્ટીંગ દ્વારા તેમનો મત ન આપ્યો હોય. તે ઉ.એ.જી.એમ માં મથાપિકારનો ઉપયોગ કરી શકશે. ઈ-ગોર્ટીંગની સુવિધા, ઈ.ઓ.જી. એમ માં હાજ રહેવાની પ્રશ્નિયા અને ઈ-નેઈલ સરનામાની નોંધણીની પ્રક્રિયા ઈ.એ.જી.એમ.ની નિક્ષિત્ર આપ્યા હોય આ હોઈ. ઈ-ગોર્ટીંગની તે પ્રત્ના કોઈ પ્રત્ન તોય તો સવ્યો/ બેનીશીસીયલ ઓનર્સ helpdeskevoting@cdsindia.com પર ઇ-મેઈલ કરી
- લેશા ઇન્ડસ્ટ્રીસ લિમીટેટ બોર્ડ ઓક સ્ટિલ્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ્ટિન્સ તા અશોક શ

સ્થળ : અમદાવાદ તારીખ : ૨૧.૦૫.૨૦૨૪ ડીઆઈએન : ૦૨૪૬૭૮૩

કાંકરિયામાં ઢોસામાં નીકળ્યો પથ્થર,ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડા

કઈ નીકળતા નિરાશા મળતી હોય વાત નો સ્વીકાર કર્યો હતો ,તેમજ છે.આવોજ એક મામલો તેમનાથી ભૂલ થઇ હોવાનું પણ અમદાવાદમા આવેલ કાંકરિયા સ્વીકાર્યું હતું. ત્યારે ગ્રાહકની અમદાવાદ આજકાલ દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે ભોજન એમ્યુઝમેન્ટ પાર્ક પાસે બની છે, જ્યાં ઢો સામાંથી પથ્થર

બનાવવાનો પણ સમય નથી. પતિ-પત્ની બંને ઘરમાં નોકરી કરે છે, જેના નીકળ્યો છે.જી હા કાંકરિયા ફૂડ અને કારણે તેઓ અવારનવાર રેસ્ટોરન્ટ. ફન માટે જાણીતું છે ત્યાં હમેસા લોકોનો મેળાવડો જોવા મળે છે, ત્યારે કારકા લખા અવાર વાર સ્લાર્ટર, હોટલમાં જાય છે અને ખાવાનું ખાય છે અથવા ઓનલાઈન ઓર્ડર કરે છે. ઘણી એવી એપ્સ છે આવી ઘટનાઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા લોકોમાં રોષ જોવા મળે છે.આપને જણાવી દઈએ આ

અમદાવાદ

ચિંતાજનક બાબત કહેવાય. સામાન્ય રીતે પહેલાના સમયમાં ૫૦ અથવા તો ૬૦ વર્ષ બાદ લોકોને

હાર્ટએટેક આવતો હતો. પરંતુ કોરોના બાદથી સીનીયર સીટીઝન ઉપરાંત બાદવા સાંગાવર સાહ્ય કરવા યુવાનો સહિત નાના બાળકો પણ હૃદયરોગના હુમલાનો શિકાર થઈ

રહ્યા છે. નિષ્ણાત ડોક્ટરના જણાવ્યા મુજબ હાલમાં બાળકોની દિનચર્યા બદલાઈ છે. એક રીતે કહી શકાય કે

અત્યારના મોટાભાગના બાળકો બેઠાડં જીવન જીવી રહ્યા છે. બાળકોમાં

શારીરિક પ્રવૃત્તિનો અભાવ જોવા

મળ્યો છે. આંજે બાળકો અભ્યાસ

જેના દ્વારા ગરમાગરમ જેના દ્વારા ગરમાગરમ ખાવાનું ઘરે બેઠા જ ઓર્ડર કરી શકાય છે.આ સિવાય ઘણી વાર લોકો ઘટના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ પ્રિન્સ રિફ્રેશમેન્ટની છે જ્યાં ઢોસામાંથી પથ્થર નીકળ્યો છે.ત્યારે ભોજનમાં આવી વ છે.જયારે તેના માલિકને અ વિશે મળવી આપણા સ્વાસ્થ્ય જણાવવામાં આવ્યું ત્યારે તેમને તે સંભવિત ખતરો ઉભો કરે છે. રજાઓના દિવસોમાં પરિવાર સાથે ભાર જમવા જતા હોય છે.પરંતુ તેમાં પણ તેમને ઘણી વાર જમવામાં કઈને

ત્રણ વર્ષમાં બાળદર્દીઓમાં ચિંતાજનક **રીતે હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું** , મહેસાલામાં ભાળકોમાં બાદનો સમય મોબાઈલ અથવા ડોક્ટરો પલ અન્ય પાસ ધતો હોવાનું સામે આવ્યું લેપટો પમાં પસાર કરે છે. આથી ચકાસલી કરી રહ્યા દ રા વર્ષમાં ભાળકદીઓમાં શારીરિક હલન-ચલનનો અભાવ આરોગ્યવિભાગઢારા મહેસાણા, મહેસાણામાં બાળકોમાં

ત્તરવાલા, તરસાવાના બાળકાના હૃદય રોગ વધતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં બાળદર્દીઓમાં ચિંતાજનક રીતે હાર્ટએટેકનું પ્રમાણ શરીરમાં લોહીના પરિભ્રમણ પર પણ વધ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત સમાચાર મજુબ ચાલુ વર્ષના માત્ર ચાર મહિનામાં ૨૦૨ બાળ દર્દીઓ્ અસર કરે છે. સંભવત આ સામાન્ય પણ મહત્વના કારણોની લીધે બાળકોમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું માહેગામાં ૨૦૨ બાળ દઠાઓ હૃદયરોગના શિકાર થયા. જયારે ૨૦૨૨માં ૩૩૩ અને ૨૦૨૩માં ૩૮૪ બાળ દર્દીઓ જોવા મૂળ્યા. આ હોવાની સંભાવનાને નકારી શકાય નહી મહેસાણામાં બાળકોમાં હૃદયરોગનું પ્રમાણ વધવાને લઈને માહિતી પરથી ખ્યાલ આવે કે સમય

ગાહતા વરવા ગ્વાલ આવે કે સગવ જતા હૃદયરોગના બાળદર્દીઓ વધી રહ્યા છે. જે આગામી સમય માટે બહુ Capital & Hou

जानपान तेमल रमतगमत प्रवत्तिने લઈને પણ સૂચન કરવામાં આવ્યું છે. ખાસ કરીને માતાપિતાએ બાળકના સર્વાંગી વિકાસ માટે મોબાઈલમાં ગેમ રમવાની જેવા ખરાબ આદતોથી દૂર રાખવા તેમને કવોલિટી ટાઈમ

Shines childs Basilization બેન્સ Basilization પ્રતાસ છે. આ ગામ આ આ ગામ આ ગામ		
ઉદ્યારકર્તાઓ / જામીનદારોનું નામ	ਤੀਸ਼ਾਰ ਗੇਟੀસਰੀ तारीખ અને રકમ એਰਪੀએਰੀ तारीખ	મુકરર મિલકતનું વર્શન
(LC No. 01800007505) / વડોદરા શાખા), હરેશસિંહ પહાર્ડસિંહ યાદવ (ઉધારકર્તા), અલ્પાબેન હરેશસિંહ યાદવ (સહ-ઉધારકર્તા ૧)	૨૨.૦૪.૨૦૨૪ / રૂદ ૧૩,૨૫,૩૧૦/- (રૂદ તેર લાખ પચ્ચીસ હજારત્રણાસો દસ પુરા) (NPA : 09.04.2024)	બ્લોક નં. ૯, સાંઈનિવાસ સોસાયટી, સનફલાવર એપાર્ટમેન્ટની પાસે, જલધારા ચોકડી, જીઆઈડીસી અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત - ૩૯૩૦૦૧.
(LC No. 04100007519) / સુરત શાખા), મુકેશભાઈ સુખદેવ સિંદે (ઉપારકતાં), પલ્લવી મુકેશ સિંદે (સહ- ઉપારકર્તા ૧)	૨૨.૦૪.૨૦૨૪ / રૂા. ૮,૦૨,૩૧૬/- (રૂા. આઠ લાખ બે હજારત્રવાસો સોળપુરા) (NPA : 09.04.2024)	પ્લોટ નં. ૯૦, ડીવાઈન રેસીડેન્સી - ૨, ડીવાઈન ચિઠ્ડ ઈન્ટરનેક્ષનલ સ્કુલની પાસે, ક્રોસંબા - ઉતીયાદરા રોડ, મોજે - હધુરલ, સુરત, સુરત, ગુજરાત - ૩૯૪૨૨૦.
(LC No. 04100008859) / સુરત શાખા), નરેશભાઈ લક્ષમહાભાઈ લુહાર (ઉધારકતાં), મીનાબેન નરેશભાઈ લુહાર (સહ-ઉધારકતાં ૧)	૨૨.૦૪.૨૦૨૪ / રૂા. ૧૩,૫૭,૦૩૮/- (રૂા. તેર લાખ સત્તાવનહજારઆડત્રીસ પુરા) (NPA : 09.04.2024)	પ્લોટ નં. ૮૧, મહાવીર ધામ રેસીડેન્સી, શ્રીજી સુપર સ્ટોરની પાસે, આઘુષ પેટ્રોલ પંપ, સાયલ - સીવલ રોડ, સીવલ, ઓલપાડ, સુરત, સુરત, ગુજરાત - ઉ૯૪૨૧૦.
(LC No. 04100009608) / સુરત શાખા), મનુભાઈ કાળાબાઈ ગોહિલ (ઉપારકર્તા), લિલાબેન મનુભાઈ ગોહિલ (સહ-ઉપારકર્તા ૧)	૨૨.૦૪.૨૦૨૪ / રૂા. ૧૪,૫૭,૯૯૮/ (રૂા. ચૌદ લાખ સત્તાવન હજાર નવસો છાસક પુરા) (NPA : 09.04.2024)	કલેટ નં. એ-૨૦૬, દાદાભગવાન રેસીડેન્સી, હનુમાન ચોકડીની પાસે, નનસાડ રોડ, ક્રામરેજ, સુરત, સુરત, ગુજરાત - ૩૯૪૧૮૦.
(LC No. 16700002130) / મહેસાજ્ઞા શાખા), ગોપાલભાઈ રામચંદ્ર લવાર (ઉધારકર્તા), રમીલાખેન ગોપાલભાઈ લવાર (સહ-ઉધારકર્તા ૧)	૨૨.૦૪.૨૦૨૪ / રૂા. ૧૪,૩૦,૧૪૨/- (રૂા. ચીઠ લાખ ત્રીસ હજાર એક્સો બેતાલીસ પુરા) (NPA : 09.04.2024)	પ્લોટ નં. ૧૦૪ પૈકી, દક્ષિણ બાજુ, શ્રીનાથજી સોસાયટી, ધાનેરા થી ડીસા રોડ, ધાનેરા, બનાસકાંઠા, ગુજરાત- ૩૮૫૩૧૦.
(LC No. 16700002137) / મહેસાલા શાખા), મનસુખભાઈ કાનજીભાઈ ચૌધરી (ઉધારકતાં), મંજુખેન મનસુખભાઈ ચૌધરી (સહ-ઉધારકર્તા ૧)	૨૨.૦૪.૨૦૨૪ / રૂા. ૨૧,૩૮.૭૯૧/- (રૂા. એકવીસ લાખ આડત્રીસ હજાર સાતસો એકાણું પુરા) (NPA : 09.04.2024)	પ્લોટનં. ૯૨, અમૃતસાગર રેસીડેન્સી, પ્લોટનં. બીન્પર, સાઈટ મુજબ, ડીસન્ટ હોટલની સામે, પાલનપુર હાઈવે, ડીસા, બનાસકાંઠા, ગુજરાત- ૩૮૫૫૩૫.
(LC No. 01800007979) / વડોદરા સાખા), હિરેન ડી ઉપાધ્યાય (ઉધારકર્તા), વિભાબેન હિરેનભાઈ ઉપાધ્યાય (સહ-ઉધારકર્તા ૧)	૨૨.૦૪.૨૦૨૪ / ફા. ૨૫,૨૮,૬૨૮/- (ફા. પચ્ચીસ લાખ છવ્વીસ હજાર છસ્સો અઠયાવીસ પુરા) (NPA : 08.01.2023)	પ્લોટ નં. ૨૪૨, કુમકુમ બંગ્લોઝ, પ્રકાર - સી, સ્વર્ગ રેસીડેન્સી ની પાસે, ઓલપાડ - સાયજ્ઞ રોડ, યુબીઆઈ બેંકની પાસે, એરીયા - સાંપીયાર, સાંધીવાર, ભરૂચ, ગુજરાત - ૩૯૨૦૦૧.
(LC No. M0209851) / અમદાવાદ શાખા), રાવલ રાજેશ મકાજી (ઉધારકર્તા), રાવલ સંજનબેન રાજેશભાઈ (સહ-ઉધારકર્તા ૧)	૨૩.૦૪.૨૦૨૪ / રૂા. ૮,૮૮,૬૬૦/- (રૂા. આઠ લાખ ઈઠયાસી હજાર છસ્સો સાહીઠ પુરા) (NPA : 04.04.2024)	કલેટ નં. સી-૨૦૩, સમોર રેસીડેન્સી, ઓમ શાંતિનગરની પાછળ, કેનાલરોડની પાસે, વટવા, અમદાવાદ - ૩૮૨૪૪૦.
(LC No. M0043805) / સુરત શાખા), આશિપ કાયરોટીયા (ઉપારક્ત!), પરેશભાઈ બી કાયરોટીયા (સહ-ઉધારક્રતાં ૧), જયાબેન બી કાયરોટીયા (સહ- ઉપારક્રતાં ૨)	ર૩.૦૪.૨૦૨૪ / રૂદ ૨૦,૯૦,૪૦૩.૭૪ (રૂદ વીસ લાખ નેલું હજારચારસો ગણ અને સુંમોતેર પૈસા પુરા) (NPA : 04.04.2024)	પ્લોટ નં. ૧૫૯, ગોકુલધામ રેસીડેન્સી, આર.એસ. નં. ૫૪, બ્લોક નં. ૪૦, ધારા રેસીડેન્સીની બાજુમાં, વેંલજા. રોખપુર રોડ, વેલંજા ગામ, સબ જીલ્લો - કામરેજ, જીલ્લો - સુરત, ગુજરાત - ગુ૯૪૧૫૦.
(LC No. M0100438) / સુરત - મજુરા ગેટ શાખા), બાનસિંગ સહાની (ઉધારકનાં), અનિતા દેવી (સહ- ઉધારકર્તા ૧)	ર૩.૦૪.૨૦૨૪ / રૂદ ૧,૯૩,૯૩૮/- (રૂદ છ લાખ ગેસઠ હજારછસ્ત્રો આડગીસપુરા) (NPA : 04.04.2024)	કલેટ નં. ૨૧૧, બીજો માપ, યોપીનાથ રેસીડેન્સી, પ્લોટ નં. ૩૭, શ્રી રેસીડેન્સી, જુનો બ્લોક નં. ૪૩૪, ૪૩૫, ૪૩૯, ૪૩૭ (ન્યુ બ્લોક નં. ૪૮૪, ૪૮૬, ૪૮૮, ૪૮૮), શીવાંની રેસીડેન્સી ની પાસે, મારે ન્લાયંષ્ઠ, સબ જીલ્લો - કામરેજ, જીલ્લો - સુરત, ગુજરાત-૩૯૪૩૧૦.
(LC No. M0110770) / જૂનાગઢ શાખા), ભાવેશ ભાનુભાઈ ભારડા (ઉધારકતાં), હેતલખેન ભાવેશ ભારડા (સહ-ઉધારકર્તા ૧)	૨૩.૦૪.૨૦૨૪ / રૂા. ૮,૩૫,૦૫૦/- (રૂા. આઠલાખપાંત્રીસ હજારપગ્યાસપુરા) (NPA : 05.12.2023)	કલેટ નં. ૩૦૧, ત્રીજો માળ, વિંગ - સી-૪, વિશ્વાસ સીટી, જૂનાગઢ, આર.એસ. નં. પ૪/૧/૨ પી૧, પ્લોટ નં. ૧, જોસીપુરા, સ્વામીનારાયલ ગુરુદ્વની પાસે, જૂનાગઢ, જોસીપુરા, જૂનાગઢ, ગુજરાત -૩૧૨૦૦૧.
(LC No. M0143906) / વાપી શાખા), હિતેન્દ્રસિંહ પી સોલંકી (ઉધારકતાં), ભૂમીકાબેન એચ સોલંકી (સહ- ઉપારકતાં ૧)	૨૩.૦૪.૨૦૨૪ / રૂદ. ૨૧,૨૮,૮૨૮/- (રૂદ એકવીસ લાખ અઠયાવીસ હજાર અઠશો છવ્વીસ પુરા) (NPA : 04.04.2024)	કલેટ નં. બી૪/૧૦૩, પહેલો માળ, બિલ્ડીંગ નં. બીજ (સાઈટ મુજબ) બિલ્ડીંગ નં.બીર (મંજૂર કરેલ પ્લાન મુજબ), ઑરીઅન ઈંમોરીયા, સ્વં નં. લર?(, લરર/૩, લરર), સામ - નારોલી, યુનિયન ટેરીટરી ઓફ દાદરા અને નગર હવેલી - ૩૯૮ ર ૩પ.
(LC No. M0143906TU) / વાપી શાખા), હિતેન્દ્રસિંહ પી સોવંકી (ઉધારકતાં), ભૂમીકાળેન એચ સોવંકી (સહ- ઉધારકતાં ૧)	૨૩.૦૪.૨૦૨૪ / રૂા. ૧૯,૩૫,૯૯૩/- (રૂા. ઓગલીસ લાખ પાંત્રીસ હજાર નવસો ત્રેસઠ પુરા) (NPA : 04.04.2024)	કલેટ નં. બી૪/૧૦૩, પહેલો માળ, બિલ્ડીંગ નં. બી૪ (સાઈટ મુજબ) બિલ્ડીંગ નં. બીર (મંદૂર કરેલ પ્લાન મુજબ), ઓરીઅન ઈંગ્મેરીવા, સ્વં નં. લગ્ર૨/1, લગ્ર૨/3, લગ્ર૨/, વામ - નારોલી, યુનિયન ટેરીટરી ઓફ દાદરા અને નગર હવેલી - ૩૯૮ ર ૩પ.
કે ઉપરોક્ત ઉપરાંતમાં ઉપરોત પુષ્પત PDFL ગુકલી કરવાય નિષભ જો તે PDFL એ કાલદની કલપ ૧૩(૪) અને શરૂ પાત નિષ્પો હેઠળ ઉપરાંત કુશ્લોન સરસ્યાઓ સોખ પંચ • પરિશાએ પોર્જોઓ પર પોર્જીઓ આજ નહીં અદેવાં અને સ્વાયતો ગે વાલ છી તરારા અલગા PDFL ગુણે વિજેત સંગતિ વિત્ય સ્વાર્તદી કરવા કાલાં હેઠળ ઉપરાંતનાં એવા તેમપંછે. કોઈપલ લાતિ જે ઈત્ત અધિનિષય અથવા નિષયોની જોગાઈએ હું ઇલપલ કરે છે અથવા તેનું ઉલ્લોગ કરે છે, તે અધિનિષય હેળ પ્રદાન કરે શકે અને 'અથવાઈ માટે રહેશે.		

: આઈસીઆઈસીઆઈ લેંક ટાવર્સ, ચકલી સર્કલ પાસે, જુના પાદરા રોડ, વડોદરા - ૩૯૦૦૦૭ iસ : આઈસીઆઈસીઆઈ લેંક ટાવર્સ, બાંદ્રા કુર્લા કોમ્પલેલ, બાન્દ્રા (ઇસ્ટ), મુંબઈ-૪૦૦૦૫ ૧ OICICI Bank

થાચી મિલકતોનું વિવરણ

સહીં

สเป็พ : มีวว ว∩ว⊀ ત્તહા (અધિકૃત અધિકારી) આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેઃ

શરેક્ટ;

ધોરણ ૯ થી ૧૨માં ટાફિક શિસ્ત અને ગીતાનાં પાઠ

અમદાવાદ,

રાજ્ય સરકાર દ્વારા જૂન ૨૦૨૪થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કરી દેવાયું છે. ૩૦મી મે સુધી પુસ્તકો શાળામાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરાયં છે. . હત્વનું છે કે શહેરોમાં સર્જાતી

ટ્રાફિક સમસ્યાને લઈ નાગરિકોમાં ટ્રાફિક અંગે સમજ કેળવાય તે હેતુથી પ્રથમ વખત ધોરણ ૯ અને ૧૦માં ટ્રાફ્રિકનું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે.

આપ્યુછ. ગુજરાત પાઠ્યપુસ્તકમંડળ દ્વારા ધોરણા ૯ અને ૧૦માં સામાજી કવિજ્ઞાનમાં અને ધોરણા ૧૧ બા લા અગ વધા શા ના માધ્યા માં અને ૧૨માં ગુજરાતી માધ્યમમાં રોડ સેફ્ટી અંગે ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે. જેમાં વાહનચાલકે ખઈ બાજુ વાહન ચલાવવું, સીટ બેલ્ટ પહેરવું, વાહન પાર્ક કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી સહિતનું વર્જો કરવામાં આવ્યું છે. ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની વય મર્યાદા, લેન ડ્રાઈવિંગ, ચોકડી, ગોળાઈ, વાહન ઓવરટેક કુઈ રીતે કરવું, તેની માહિતી આપી મહત્વ પણ

રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ ભગવદ ગીતાના પાઠ તબક્કાવાર અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેસરી – અમારાવાદ કિવિઝક્ત DoSa હોલ્ડ આલ્સાનો ન સ્વાસ્ટેલેના ઇ-ટેન્ડ સુચના ને Sr. D EF /A D I / 10 (2425) cl. - 105.2024 ટેન્ડ નંબર : EL-50-1AD): - 19-2024-25 1.36મનું નાય (2425) cl. - 105.2024 ટેન્ડ નાયરેક્ટ અંધતિત ઇલિફિલ્લ કાર્ય . 2- સ્વાસ્ટિલ કિમ્બ (21.8.2).31-32-32 એન્સર્ટ સ્વાની છેલ્લી તારીબ અને સ્વપ્ય: 13.06.2024 ના 15:00 કલાક સુધી કરન્ડ સુધી અભીટ સ્વાના છેલ્લી તારીબ અને સ્વપ્ય: 13.06.2024 ના 15:00 કલાક સ્વી 13.06.2024 ના 15:00 કલાક દેન્સોફિસ્ટ સ્વન્યાં : સીધવાર, નવેલા સે, અલ્લુરા અલ્પાં : સીધવાર, નવેલા સે, અલ્લુરા

વેબસાઇટ <u>www.ireps.gov.in</u> ની ઉપર જણાવેલ ટેન્ડરો માટે ઓન કરવાની છેલ્લી તારીખ 18.06.2024

અર૧ કરી

www.ireps.gov.in 35 અપને સાઇડ ડરો: 🗗 facebook.com/WesternRly અપને સાઇડ ડરો: 🗗 facebook.com/WesternRly શ્રીરામ હાઉસીંગ ફાયનાન્સ લિ.

રાશ્વસ્થર્ડ ઓઉસ : ઓઉસ નં. ૧૨૩, અંગપ્યા માઉસ રહે, ગે નાઈ-૧૦૦૦૦ા. હંક ઑઉસ : વેસવ - ૧, વોક્યર્ટ વાર્ચ, પૂર્વ વિંગ, સી-૨, બ્લોક - જ, બાન્તા હુરલા કોમ્પ્લેસ, યુંમઈ : ૪૦૦૦૫ . વેલસાઈ : ૫૫ww.shirambousing.in

સાંકેતિક પઝેશન નોટીસ

ાારા (તરુ પગ્ર શાં જો) ટીસ અધી **કા**યો **કા બાં કા બાં જા વિવાર જાય છે. (SHFL)** ના ની યે સહી કરનાર અધિકૃત અધિકારીએ લિક્રચોરિડાઇ ડેશન એન્ડ વી કસ્ટ્રકાર અંક કાયના વ્યિયલ એસેટ્સ અંગ્-અંગે સાંયેન્ટ ઓક લિક્રચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ડોસોનેન્ટ) નિયમો, ૨૦૦૨ તથા નિયમ રહેતવા વધા અંગે બોની સાના નોટીસ જારી કરીને ની ચે દશાંવેલ ટેબલમાં દશાંવેલ રકમ ચુકવા જણાવેલ.

યુકવા જણાવેલ. પિયટ રાતેઓ પૈપરીટન રક્ષ ચુકવામાં ક્યુરવાર થતાં આપી પૈપાર કતાંઓ તથા જાવેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અપિનિયમ 13ની પેટા કલમ (૪) ડેતળ રૂવ ૧૪ થયો વારડા વુડ્ડા કરતાં તા. ૧૨ તા. ૧૨ જના રોજ નીવે જણાવેલ વિલાકનો સોકેતિક corn લઈને સોંપેલ છે. પિયટ કતોને દિષેશ રૂપથી તથા જાવેર જનતાને આપી સરાદ્વ વિલાકન અને કે છેપિય જાતનો વલ્લાદન 1 કરવાનો વેતવારી આપવામાં આવે છે. સરદવુ સ્થાપ્તી વિલાક અને કે રો છેપિય લાવતા 2 સીમાન affahis ordiname flowlas ની પે પુજ્યને વિલાક ને કે રો છેપિય લાવતા 2 સીમાન affahis ordiname flowlas ની પે પુજ્યને વિલાક ને કે સ્ટેશ હેપિય લાવતા 2 સીમાન affahis ordiname flowlas ની પે પુજ્યને વિલાક નિયાન ક્યો કે સંદર્શ હેપિય લાવતા 2 સીમાન affahis ordiname flowlas ની પે પુજ્યને વિલાક ને જો છેપિય લાવતા 2 સામાન બીમાં વાર તેઓ વાર કલમ ૮ ની એટવાય પાને ઉપાસ્તાનીઓનું પુરુષ્ટ બિલકત છેકાલવા માટે મળવા પાત્ર સમય ભાભતે વિલાન દેવામાં ભાવે છે."

મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે."		
ઉધારકર્તાનું નામ અને સરનામું	ડીમાન્ડ નોટીસ હેઠળ બાકી લ્હેંણી રકમ	
(૧). ૨ છે છે એટઆઇઝ તેમના ગોમાઇટ દિલ્લાચાલ તોઝલા મોટ, નાસ્સા સરલાનું : ગી. 1, આરંદ ચંગલ ક્રોમચેક્ષ, સમુલ ગાર્ડાની સામે, શયા કોસ રૉ, આંબાવાડી, આરંદવાડ અને અલી દિજાએવા સરબાનું : વોર્ડ નં 1, 7, વિગ બાસ, શ્રી દ્વારગઢ, વિક્રાનેટ, રાજસાન- ડર (પાટડ) અને અલી ભિલ્લતનું સરબામું : ગોકિંસ નં પરટ, પાંચમે માળ, અવિરાજ ભિપ્તાહસ, ક્યાંતની × ૧ી સામે, ડીવાઈન લાઈક સુસની પાસે, વટવા - નારોલ, અમદાવાદ - ડર ૪૪૦૦. (૨). દિલ્દસાલ ભીરબલ મોટ, કાયમી સરબામું : ગોકિંસ નં પરટ, પાંચમો માળ, અવિરાજ ભિપ્તાહસ, ક્યાંતની - ૪ ની સામે, ડીવાઈન લાઈક સુસની પાસે, વટવા - નારોલ, અમદાવાદ - અને અલી ભિલ્લતનું સરબામું : ગોકિંસ નં પરટ, પાંચમો માળ, અવિરાજ ભિપ્તાક, ક્યાંતની - ૪ ની સામે, ડીવાઈન લાઈક સુસની પાસે, વટવા - નારોલ, ગાંડ ગાંદ બાઝ અલી ભિલ્લતનું સરબામું : ગોકિંસ નં ૧૪, ગિય બાસ, શ્રી દ્વેષર ભિપ્તક, ક્યાંતની - ૪ ની ૧૪, વિગ બાસ, શ્રી દ્વેષર ભિલ્લન સ્ટલાયું સરબામું : વોર્ડ ન ૧૪, પાંચમો માળ, અવિરાજ ભિપ્તક, ક્યાંતની - ૪ ની ૧૪, ચિંગ અલી વિસ્ટલ સ્ટલામું : આંડિસ નં ૧૩, ૧૮૦, પાંચમો માળ, અવિરાજ ભિપ્તક, ક્યાંતની - ૪ ની સામે, ડીવાઈન લાઈક સુસની પાસે, વટવા - નારોલ, આ	રૂ ા. ૩૦, ૭, ૨૫૯)- (રૂ. ગીસ લાખ બોતે પાજર બસ્સો છપાન પુરો, તા. ૦૭૦૩.૨૦૨૪ ના ચુપીનું. લોન એકાઉન્ટ . પ્રે. પ્રેમ તે અન્ય સેસ્ટ અને અન્ય સેસ્ટ અને અન્ય સેસ્ટ અને અન્ય સેસ્ટ અને અન્ય સેસ્ટ સ્વાર્ચ અને અન્ય પ્રેસ્ટ સ્વાર્ચ અને અન્ય પ્રેસ્ટ સ્વાર્ચ અને અન્ય પ્રેસ્ટ સ્વાર્ચ અને અન્ય સેસ્ટ સ્વાર્ચ અન્ય સેસ્ટ સ્વાર્ચ સ્વાર્ય સ્વાર્ચ સ્વાર્ચ સ્વાર્ચ સ્વાર્ચ સ્વાર્ચ સ્વાર્ય સ્વાર્ય સ્વાર્ચ સ્વાર્ય સ્વાર	

અમદાવાદ - ૩૮૨૪૪૦.

(٩)

(૨). ક

સર્વોદ

പം

સ્થળ : અમદાવાદ તારીખ : ૨૧.૦૫.૨૦૨૪

ગિરવે મુકેલ મિલકતનું વર્ણન તમામ ભાગ અને હિસ્સા સાથેની શ્રી હોય સ્માહનજી પાઠ્યા માળ, કાઈર એરીપાનું શેનકળ ૪૦. ૭૨ સં. મી. (એટલે કે બિલ્હ અપ એરીપાનું શેનકળ ૪૩. પા સ્ટે.મી. અને સુપર બિલ્ટ અપ એરીપાનું શેનકળ (૯૩૯. ૩૪ સ્ટે.મી.) એરિયાજ પીનાકલ થી જાશીતો એરીપા, જે સ્થિત જ્યોનનો સર્વ નં. ૫૮૮/૨, કાઈનલ પ્લોટ નં. ૩૮/૧, શેનકળ ૭૧ દર સં.મી., પૈક્ષે સખ પ્લોટ નં. ૧, શેનકળ ૨૮૬ સ્ટ સ્કે.મી. ટાઉન પ્લાનીંગ સ્ક્રીમ નં. ૦૦, મોજે - વરવા, તાલુકો - વરવા, જીલ્લો અમદાવાદ અને રજીસ્ટ્રેશન સબ જીલ્લો - અમદાવાદ - ૧ (અસલાલી), રાજ્ય -ગજરાન ગુજરાત. ⊶⊶⊐ીચ્ગઃ- પર્વેઃ માર્જીન જગ્યા, પશ્ચિમે : ઓફિસ નં. પ૨૮ પછી કોમન દિવ

લπરે:માર્જનપછી મેઈનરોડ, દક્ષિણે: જગ્યા અને ઓફિસનં. પ૨૮.		
Bruse of James and an ami	0	

ારક્તનિ નામ અને સરનામું	ડીમાન્ડ નોટીસ હેઠળ બાકી લ્હેંણી રકમ
. બી કેલાશકુમાર ચૌલાશ (ઉધારકતા), ગ્રીમાની લાઉલાએન કેલાસભાઈ ચૌલાયા (સ્લઉધારકતા), સરવાપું: સ્લેટ વં. ૧૮૦૩, મ રેસીડેન્સી, અચેર કોસ રોડ, વનગર સાંસાયસું: સ્લેટ નં. ૧૮૦, મગરદાસા ૨- ૩૮૦૦૦૫ બી કારનામું: ૧૬ ચેટ -ાં. પ૦, મ રેસીડેન્સી, અંચેર રેસીડેન્સી, માર્ટેદાઈ - સ્ટે૦૦૦૫.	રા. ૪૧,૭૯,૧૬ ૪૮- (રૂ. એકતારી લા લાખ ઓગ્લાઝેની હાય છા સ્પ્રં વોલી પુણ), તા. ૦,૦,૦,૩,૦૦ ૪૧ વા સુધીનુ લો એ હાર્ચ ૬ ૨ SHLAAHEAD001077 સ્. ૧,૫,૫,૦,૯૮૯/- (રૂ. એક લાપ પલ્યાવન હારસ સાતાનો નેવાસી પુણ), તા. ૦,૦,૦,૩,૨૦૪૪ તા સુધીનું હોવ એકતરે ૨ : દી. સ્મિનિAMEAD001078 ચઠત ત્લાજ અને અથ્વા હોય સ્ટે આને અન્ દિવસની અંદર ૨ક્મ ભવ્યા જ્યાલેલ ૧.(૨), હેઠળ સીપન નોઝીસ તા. ૧.(૨), ઢઠળ સીપન નોઝીસ તા.

ત્તપાદ્યવગર, સાબરમતી, અમદાવાદ - ૩૮૦૦૦૫.

ગિરવે મુકેલ મિલકતનું વર્શન િક્રાએ શુકેલ ભિક્રતનું વાર્કા તપાય ભાગ અને હિસ્સા સાથેની સ્થાવર ચિલકતનો રહેશાંક બિલકાનો કલેટ નં. પણ, પાંચમાં ભાગ, એરીયાંનું તૈનકળ ૯૭.૮૨ સ્કે.મી. (લુપર બિલ્ટ અપ), અવિબાજીત હક અને હિસ્સા સાથેની જમીન પર આગમ રેસીડેની થી જાલીતું પાંચમાં તે સપ પાંટે નં. અને ગે. ડુડ, હ્લે અરીયાંનું તેકળ ૭૪૮.૩૦ સ્કે.મી. સાર્વોદય સોસાયટી, જમીનનો ટેવન્યુ સર્વે નં. ૧૯૧/૧ થી ૬, ૯ થી ૧૧ અને ૧૩ શે. પડ, હાઉનલ પાંચ નં. પ ૬૧, પડ અને પ ૯૮, ટાઈન પાનિંગ સ્વીમ નં ગ શે રહ્યુ સ્ક્રીમાં ન્યુપ્ટે લહેર મં. અપેર, તાલુકો – સાબરમતી અને જીલ્લો અમદાવાદ, રહ્ય્યસ્ટ્રેશન સબ જીલ્લો અને જીલ્લો અમદાવાદ -ર (લાસ્ક). દક્ષુસ્ત્રીમાં ન્યુટ્ટ્રો કહેર મં. પડ, પ્રાબ્ને કરળ અમદારાદ -ર (લાસ્ક). દક્ષુસ્ત્રીમાં ન્યુટ્ટ્રો કહેર મં. પડ, પ્રાબ્ને કરળ અમરે સંક્રો દક્ષેટ તં. પ૦૧, દક્ષિત્રોક ગ્રન્ટ

-૧૯૯७ અધિકૃત અધિકારી શ્રીરામ હાઉસીંગ ફાઈનાન્સ લિમીટે:

અમદાવાદ વિશેષ

૨૦૦૧માં રિલીઝ થયેલી ફિલ્મ

નિર્માતાઓએ કિલ્મ નાયક ૨ સંબંધિત

કેટલીક બાબતોની પુષ્ટિ કરી છે. ફિલ્મ

નાયકની સિક્વલ ઓવશે કે નહીં, ફિલ્મ

આવશે તો અનિલ કપૂર અને રાની મુખજી તેમાં હશે કે નહીં, ફિલ્મના નિર્માતાઓએ આ તમામ બાબતોનો

પદીફાશ કર્યો છે. તેણે આ અંગે કેટલાક

ખુલાસા કર્યા છે, ચાલો તમને તેના વિશે

પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન

ફરી 'નાયક' અવતારમાં જોવા મળશે અનિલ કપૂર

જણાવીએ, પિંકવિલાના અહેવ

છે કે 'નાયક ૨' પ્રક્રિયા હેઠળ છે

ફિલ્મ નિર્માતા દીપક મુકુટે ખુલાસો કર્યો

પશ્ચિમ રેલવે - ભાવનગર ડિવિઝન

નાયક તે દાયકાની ફ્લોપ ફિલ્મ હતી. જ્યારે આ ફિલ્મ ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી અને વારંવાર બતાવવામાં આવી ત્યારે તે લોકોની પ્રિય બની ગઈ હતી. આ ફિલ્મે ટીવી પર ભણાવાશે બોક્સ ઓફિસ પર એટલી કમાણી કરી ન હતી. સોશિયલ મીડિયા પર આ અંગેના મીમ્સનો પૂર જ બતાવે છે કે તે સમય આ ફિલ્મ કેટલી હિટ હશે.

સતર્કતાએ કારણે આ મામલો સામે આ વ્યો છે.ભો જનમાં મસાલા મનપસંદ વાનગીઓમાં સ્વાદ અને

માટે હંમેશા પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ જો એજ ભોજનમાં પથ્થર

સુગંધ ઉમેરતા ઉત્કૃષ્ટ ઘટકો, રાંધણ . ન ભાવોને વધારવાની તેમની ક્ષમતા

મળી આવે તો તે ભોજન ખાવા લાયક રહેતું નથી.ત્યારે ગ્રાહકની સતર્કતાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે.ત્યારે ભોજનમાં આવી વસ્તુઓ

સાઓ અંગે પણ ચકાસણી કરી રહ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગદ્વારા પણ બાળકોના

સમજાવવામાં આવ્યું છે આપવા જણાવ્યું છે. માસ વેચીકલ એન્ડ લાઉમીંગ દ્વારાનાના વિ. આ ગોમાં પ્રારંગ કે ગોમાં ગો આ ગોમાં ગ ડાંગ્રાઓ ગોમાં ગોમ ગોમાં ગોમા

કબ્જા નોટિસ

એપેન્ડિક્ષ-આઈવી